

IIT-GNમાં યોજાશે 'અમલથિયા 2015'

સિટી રિપોર્ટર  @ahm_cb

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા ટેકનિકલ સમિટની છઠ્ઠી એડિશન 'અમલથિયા'15'નું આયોજન

24-25 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. આ વર્ષની 'અમલથિયા'ની થીમ 'ટુવર્ડ્સ ધ ફ્યુચર' છે. આ એન્યુઅલ સમિટમાં ટેકનોલોજીકલ નોલેજ અને ઈન્ડસ્ટ્રીનાં લોકો સાથેનું ઈન્ટરેક્શન

કરવામાં આવશે. આ સમિટનો હેતુ છે કે ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ થાય. આ ઉપરાંત અમલથિયામાં 'બિલ્ડિંગ સસ્ટેનેબલ ફ્યુચર થ્રુ વિઝન એન્ડ ટેકનોલોજી'ની થીમ પર કોન્કલેવ પણ થશે. તેમજ 'એનર્જી

એન્ડ ઈકો-ફ્રેન્ડલી ટેકનોલોજીઝ' વિષય પર એક્ઝિબિશન પણ યોજવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વર્ષે સૌપ્રથમ વખત 'બાયો-એન્જિનિયરિંગ' વિષય પર ચર્ચા કરવામાં આવશે.